

**દરરોજ ફૂકું ઓડી જ મિનિટ તમારા પગની**  
**સંસાળ લેતાં લખિયામાં ઘણી સમસ્યાઓ આડકાવી**  
**શક્ય છે. નીચે આપેલી સંસાળ તમને તમારા**  
**પગની યોગ્ય સંસાળ લેવામાં મદદ કરશે.**

**પગની સમસ્યાઓ કેવી રીતે ઊભી થાય છે?**

ડાયાબીટીજ દ્વારા સાથળથી પગનાં આંગળાં સુધી શાનતંતુઓને ઈજ પહોંચી શકે છે, જેના પરિણામે સંવેદન શક્તિ જતી રહે છે. પગ પર કોઈ પણ પ્રકારની ઓચિંતી થતી હાનિ અથવા ઈજ (દા.ત. તંગ જોડા પહેરવાથી થતી કપાસી)ની અસર કદાચ વરત ન રહતાય અને તો પણ તેથી ચાંદા પડવા જેવી વધુ ગંભીર સમસ્યાઓ જાબી થઈ શકે તેમ છે.


ડાયાબીટીજના કારણે આખા પગને લોહી પૂરું ન પડતાં તમારા એડીથી આંગળાં સુધીના પગ ઠંડા પડી જાય છે અને તેમાં પીડા થાય છે. આને લીધિ, પગને થતી ઈજને મટી જતાં કદાચ વાર લાગી શકે અને તેમાં જલદીથી ચેપ પ્રસરી શકે.

## તમારા પગને તપાસો

ઈજ થયેલી ચામડીને લીધિ પગમાં ચેપ પ્રસરી શકે છે. તમારા પગને ધ્યાનથી તપાસી જુઓ કે તેમાં કાપા અને ઉજડા, સોજ અને લાલાશ અથવા રંગબદલો નથી પડ્યાં ને! જો તમને બરાબર ન હેખાનું હોય તો બીજા કોઈની તે તપાસવાનું કહો. તમારા પગનો સ્પર્શ કરવાથી તેમાં થયેલાં ઢીમડાં, સોજ અને જ્યાં ચામડી ગરમ કે ઠંડી થઈ ગઈ હોશ તેવી જગ્યાને શોધી કાઢવામાં પણ મદદ મળશે. કોઈ



પણ કાપો કે ઉજડા હોય તો તેને પાણીથી ધોઈ નાખી ઉપર પટ્ટી ચોડો. તમારા કિરોપટિસ્ટ (પગ પર થયેલી ઈજનો ઉપચાર કરનાર) અથવા ડોક્ટરનો સંપર્ક કરો.




## પગ અવારનવાર ધોતાં રહો

તમારા પગ દરરોજ ધોવા અને તપાસવા અગત્યનું છે. નવસેકું પાણી અને કોમળ સાખુ વાપરવો. તેમને બરાબર રીતે પણ નરમાશથી લૂધી કોરા કરવા. પગનાં આંગળાં વચ્ચે લૂધવાનું ભૂલશો નહીં. ચામડીને મુલાયમ અને કોમળ રાખવા માટે ભીનાશ વધારે તેવું એટલે કે મોઈસ્ટ્રાઇઝીગ કીમ વગાડવું પણ તે આંગળાં વચ્ચે ન લગાડવું કેમકે તે ચામડીને વધુ પડતી ભીની બનાવી શકે તેમ છે.


## તમારા પગને દૂઝવા ન હેશો

ડાયાબીટીજ વાળી ઘણી વિકિન્ઝોની જેમ તમને પણ તમારા પગમાં ગરમી, ઠંડી કે પીડાની સંવેદના સારી રીતે ન થતી હોય. આને લીધિ તમારે અમુક આપચેની જગવવી જરૂરી છે. દાખલા તરફે ગરમ પાણીની કોથળીથી દાખલાય નહીં તેની સંભાળ લેવી. જો તમે ઈલેક્ટ્રિક બ્લાન્કેટ (ધ્યાનની વાપરતાં હો, તો જેંઘ આવી જાય તે પહેલાં તેની સ્વીચ બંધ કરવાનું ભૂલશો નહીં. કૃષ્ણ અને રેડિએટરથી પગને દૂર રાખવા. નહાવાના ટબમાં પગ મૂકતાં પહેલાં પાણીનું ઉષ્ણતામાન કોણીથી તપાસી લેવું.



## પગના નખ

સામાન્ય રીતે પગના નખ સીધેસીધા કાપવા જોઈએ. નખની આજુભાજુ કાપવું કે ખોતરવું નહીં. જો તમને ઓડી સંવેદના થતી હોય કે પગમાં લોહીનું ભૂલશો ઓછું થઈ ગયું હોય, તો આ કામ કિરોપટિસ્ટ પર છોડી દેવું વધુ સલામત રહેશે. સલાહ માગો.




## કપાસી અને કઠણ ચામડી

કપાસી અને કઠણ ચામડીનો ઈલાજ કિરોપટિસ્ટ પાસે કરાવ્યો જોઈએ. તેને જોતે કાપવાનો પ્રયત્ન ન કરવો કે ન કપાસી કાઢવાની દવાનો ઉપયોગ કરવો.

## તમારા જોડા નિયમિત તપાસો

જોડા બંધબેસતા હોવા જોઈએ. ઉપર વાદળી બંધાય, ઉપરનું ચામડું મુલાયમ હોય અને આંગળાંની આજુભાજુ સરખી જગ્યા હોય તેવા જોડા વધુ સારા રહેશે. આથી તમારા પગના સ્નાયુઓને સરખી રીતે કામ કરવાની મોકણાશ રહેશે અને ઘર્ષણ થતું અટકશે. જોડા લેવા જાવ તારે હંમેશ તમારા પગનો માપ લેવા માટે કહો. શરૂઆતમાં નવા જોડા એક બે કલાક માટે જ પહેરવા. હંમેશ સ્વચ્છ અને માપસરનાં મોજાં અથવા સ્ટોકીઝ્સ પહેરવાં. તમારા જોડા, મોજાં અને સ્ટોકીઝ્સ પહેરતાં પહેલાં દર વખતે જેવું કે તેમનાં પર કોઈ ખરાબી થઈ નથી ને! જોડામાં પડેલી ફાંટ, કાંકરી કે ભીલીથી ચામડી પર બંજવાળ જીપે છે અને તેને ઈજ થઈ શકે છે.



## ધૂમપાન કરતું નહીં

ધૂમપાન લોહીના

ભ્રમણને બગતી

સમસ્યાઓને વીજરાવે

છે. ધૂમપાન છોડવા

માટેની સલાહ અને


પત્રિકાઓ માટે તમારા

આરોગ્ય કેન્દ્ર (હેલ્થ સેન્ટર્સ) ખાતે પૂછો. ધૂમપાન છોડવા

માટેનાં સ્થાનિક કિલનિકો વિશેની વધુ માહિતી માટે તમારા


સ્થાનિક 'હેલ્થ પ્રોમોશન યૂનિટ' (આરોગ્યને પ્રોત્સાહિત

કરતું કેન્દ્ર)નો સંપર્ક કરો.



## આસ સલાહ

અહીં લખેલી કોઈ પણ સલાહ આસ તમારા પગ વિશે છે.



Designed by Richard Hourston

Gujarati translation by Dilip Popat & Bhadra Vadgama

More leaflets like this available from

[www.diabeticfoot.org.uk](http://www.diabeticfoot.org.uk)

Revised 23/02/2001

## ડાયાબીટીઝથી પીડાતી વાંનિઓ માટે કિરોપડીની સેવાઓ

તમારું સ્થાનિક ડાયાબીટીઝ કેન્દ્ર છે:

ટેલિફોન:

તમારું સ્થાનિક કિરોપડી કિલનિક છે:

ટેલિફોન:

ડાયાબીટીઝ

[મીઠો પેશાળ/ મધુપ્રમેહ] વાળા

લોકો માટે

તંકુરરત પગ વિશેનું

કુમાર માર્ગદર્શિન

Gujarati